



**DII-002-002403** Seat No. \_\_\_\_\_

**M. Com. (Sem. IV) (CBCS) Examination**

**May / June – 2015**

**Advanced Research Applications**

(ઉચ્ચતર સંશોધન ઉપયોગિતા) (New Course)

**Faculty Code : 002**

**Subject Code : 002403**

Time :  $2\frac{1}{2}$  Hours]

[Total Marks : 70]

- Syllabus : (1) બધાજ પ્રશ્નો ફરજીયાત છે.  
 (2) પ્રશ્ન-1 M.C.Q.નો છે. તેના 20 ગુણ છે તેના જવાબ ઉત્તરવહીમાં આપવાના છે.  
 (3) કુલ પાંચ પ્રશ્નો રહેશે. બધા ફરજીયાત છે.  
 (4) પ્રશ્ન ક્રમાંક (2) અને (3) 12 ગુણનો તથા ક્રમાંક (4) અને (5) 13 ગુણનો છે.

**1 M.C.Q. : 20**

- (1) અન્વાયોજનની યોગ્યતા માટે \_\_\_\_\_ પરીક્ષણાનો ઉપયોગ થાય છે.  
 (A) t (B)  $\chi^2$   
 (C) Z (D) F
- (2)  $\chi^2$  પરીક્ષણએ નીચેનામાંથી કયું પરીક્ષણ છે ?  
 (A) પ્રાચલીય (B) અપ્રાચલીય  
 (C) (A) અને (B) બન્ને (D) ઉપરનામાંથી એકપણ નહિ
- (3) જો  $x_c^2 \leq x_t^2$  થાય તો  $H_0$ -નો \_\_\_\_\_ થાય છે.  
 (A) અસ્વીકાર (B) સ્વીકાર  
 (C) (A) અને (B) બન્ને (D) ઉપરનામાંથી એકપણ નહિ
- (4) ANOVAની રીત કોણો વિકસાવી હતી ?  
 (A) કાર્લ પિયર્સન (B) ફિશર  
 (C) સ્પીયરમેન (D) આમાંથી એકપણ નહિ

- (5) સમાણિના વિચરણનું પરીક્ષણ કરવા માટે \_\_\_\_\_ નો ઉપયોગ થાય છે.
- (A) t-પરીક્ષણ (B)  $\chi^2$ -પરીક્ષણ  
 (C) F-પરીક્ષણ (D) Z-પરીક્ષણ
- (6) જે  $F = \frac{S_1^2}{S_2^2}$  then  $S_2^2 \dots S_1^2$  ?
- (A) વધારે (B) ઓછું  
 (C) બરાબર (D) આમાંથી એકપણ નહિ
- (7) વિચરણની પૃથક્કરણની રીતમાં કોઈ એક વિષય શીખવવાની વિવિધ રીતોને \_\_\_\_\_ કહેવાય છે.
- (A) બ્લોકો (B) માવજતો  
 (C) ઉપઝો (D) આમાંથી એકપણ નહિ
- (8) વિચરણના પૃથક્કરણની રીતમાં કયા પરીક્ષણનો ઉપયોગ થાય છે ?
- (A) t-પરીક્ષણ (B) F-પરીક્ષણ  
 (C) Z-પરીક્ષણ (D) એકપણ નહિ
- (9)  $H_0 : \mu_1 = \mu_2 = \mu_3$  નું પરીક્ષણ કરવા માટે કઈ રીતનો ઉપયોગ થાય છે ?
- (A) t-પરીક્ષણ (B) વિચરણના પૃથક્કરણ  
 (C) Z પરીક્ષણ (D) ઉપરનામાંથી એકપણ નહિ
- (10) ઉત્પાદનનું મુખ્ય અંગ ક્યું છે ?
- (A) યંત્રો (B) કાચોમાલ  
 (C) કારીગરો (D) ઉપરનામાંથી એકપણ નહિ
- (11) \_\_\_\_\_ વિતરણનો P-ચાર્ટની રચનામાં ઉપયોગ થાય છે.
- (A) પોયશન (B) દ્વિપદી  
 (C) પ્રામાણ્ય (D) એકપણ નહિ
- (12) ઉત્પાદકના જોખમને \_\_\_\_\_ વડે અને ગ્રાહકના જોખમને \_\_\_\_\_ વડે દર્શાવાય છે.
- (A)  $\beta, \alpha$  (B)  $\alpha, \beta$   
 (C) p, q (D) આમાંથી એકપણ નહિ

- (13) એક નિર્દર્શન યોજનાને \_\_\_\_\_ વડે દર્શાવાય છે.  
 (A) (N, n) (B) (N, n, c)  
 (C) (n, c, N) (D) આમાંથી એકપણ નહિ
- (14)  $P' = 0 \rightarrow AOQ = \underline{\hspace{2cm}}$  અને  $P' = 1 \rightarrow AOQ = \underline{\hspace{2cm}}$ ?  
 (A) 0,1 (B) 0, 0  
 (C) 1, 0 (D) 1, 1
- (15) \_\_\_\_\_ યોજના (પ્લાન) સમજવા માટે સરળ છે.  
 (A) દ્વિનિર્દર્શન યોજના (B) એકનિર્દર્શન યોજના  
 (C) જુદી-જુદી યોજના (D) ઉપરનામાંથી એકપણ નહિ
- (16) ચલ માટેના આલેખ ક્યા વિતરણના સિક્કાંત મુજબ કાર્ય કરે છે ?  
 (A) પ્રામાણ્ય વિતરણ (B) દ્વિપદી વિતરણ  
 (C) પોયસન વિતરણ (D) ઉપરનામાંથી એકપણ નહિ
- (17) 'C' આલેખ ક્યા વિતરણ પર આધારિત છે ?  
 (A) પોયસન વિતરણ (B) પ્રમાણ્ય વિતરણ  
 (C) દ્વિપદી વિતરણ (D) ઉપરનામાંથી એકપણ નહિ
- (18) સ્વીકૃત નિર્દર્શનમાં કેટલા પ્રકારની ભૂલો થવાની સંભાવના છે ?  
 (A) બે (B) ત્રણ  
 (C) ચાર (D) એક
- (19) 'P' આલેખએ શેના માટેનો આલેખ છે ?  
 (A) ગુણાર્થમાં (B) ચલ  
 (C) (A) અને (B) બન્ને (D) ઉપરનામાંથી એકપણ નહિ
- (20) નિર્દર્શનની મહત્વમંગ્લિત અને લઘુત્વમંગ્લિતના તફાવતને શું કહેવાય છે ?  
 (A) વિસ્તાર (B) પ્રમાણિત વિચલન  
 (C) મધ્યક (D) ઉપરનામાંથી એકપણ નહિ

- 2 અન્વાયોજનની યોગ્યતાનું પરીક્ષણ કરવા માટે  $\chi^2$  પરીક્ષણ સમજાવો. 12

**અથવા**

- 2 ચાર સિક્કાઓને 160 વખત ઉછાળતા નીચે પ્રમાણે છાપની સંખ્યાનું વિતરણ મળે 12  
છે. આ માહિતીને આધારે એમ કહી શકાય ખરૂકે સિક્કાઓ અનભિનત [દોષ રહિત] છે ?

છાપની સંખ્યા (x)	0	1	2	3	4
આવૃત્તિ (F)	17	52	54	31	06

- 3 નીચેની લેટીન ચોરસ પ્રયોગની માહિતી માટે વિચરણનું પૃથક્કરણ કરો : 12

A(12)	C(19)	B(10)	D(8)
C(18)	B(12)	D(6)	A(7)
B(22)	D(10)	A(5)	C(21)
D(12)	A(7)	C(27)	B(17)

**અથવા**

- 3 ઉદાહરણ દ્વારા એક ગુણાધર્મીય વર્ગક્રણ માટેની વિચરણના પૃથક્કરણની રીત સમજાવો. 12

- 4 આંકડાશાસ્ત્રીય ગુણવત્તા નિયંત્રણ એકમની જવાબદારીઓ જણાવો. 13

**અથવા**

- 4 નીચેની માહિતી પરથી  $\bar{x}$  અને R-આલેખની રચના કરો : 13

નમુનો નં.	1	2	3	4	5	6	7	8	9	10	કુલ
R	6	4	6	8	4	7	7	5	6	5	58
$\bar{x}$	51	46	43	47	45	44	37	49	43	37	442

[ $n = 4$ ,  $A_2 = 0.729$ ,  $D_3 = 0$ ,  $D_4 = 2.282$ ]

- 5 નોંધ લખો : - એક નિર્દર્શન યોજના (SSP). 13

**અથવા**

- 5 નોંધ લખો : - દ્વિનિર્દર્શન યોજના (DSP). 13

## ENGLISH VERSION

### Instructions :

- (1) All questions are compulsory.
- (2) Q. 1 M.C.Q. are total **20** marks all answers in answer book.
- (3) Total five questions. All are compulsory.
- (4) Q. **2** and Q **3** are **12** marks and Q. **4** and Q. **5** are **13** marks

**1 M.C.Q. : 20**

- (1) \_\_\_\_\_ test for goodness of fit.
  - (A) t
  - (B)  $\chi^2$
  - (C) Z
  - (D) F
  
- (2) Which of the following is  $\chi^2$  test ?
  - (A) Parametric
  - (B) Non parametric
  - (C) Both (A) and (B)
  - (D) None of the above
  
- (3) If  $x_c^2 \leq x_t^2$  than  $H_0$  is \_\_\_\_\_
  - (A) Rejected
  - (B) Accepted
  - (C) Both (A) and (B)
  - (D) None of the above
  
- (4) Who developed the theory of anova ?
  - (A) Karl Pearson
  - (B) Fischer
  - (C) Spearman
  - (D) None of these
  
- (5) \_\_\_\_\_ test used for testing population variance.
  - (A) t-test
  - (B)  $\chi^2$ -test
  - (C) F-test
  - (D) Z-test
  
- (6) If  $F = \frac{S_1^2}{S_2^2}$  then  $S_2^2 \dots S_1^2$ 
  - (A) Greater
  - (B) Less
  - (C) Equal
  - (D) None of these

- (7) In ANOVA method learning of any subject which technique used ?  
(A) Blocks                                  (B) Treatments  
(C) Yield                                      (D) None of the above
- (8) Which test is used for analysis of variance ?  
(A) t-test                                    (B) F-test  
(C) Z-Test                                    (D) None of the above
- (9) Which test is use for testing  $H_0: \mu_1 = \mu_2 = \mu_3$  ?  
(A) t-test                                    (B) Analysis of variance  
(C) Z test                                    (D) None of the above
- (10) Which factor is main production ?  
(A) Machine                                (B) Raw material  
(C) Workers                                 (D) None of the above
- (11) \_\_\_\_\_ distribution is used in the construction of P-chart.  
(A) Poisson                                 (B) Binomial  
(C) Normal                                 (D) None of the above
- (12) Consumer's risk known as \_\_\_\_\_ and customer's risk known as \_\_\_\_\_.  
(A)  $\beta, \alpha$                                 (B)  $\alpha, \beta$   
(C) p, q                                    (D) None of the above
- (13) Single sampling plan known as \_\_\_\_\_  
(A) (N, n)                                 (B) (N, n, c)  
(C) (n, c, N)                             (D) None of these
- (14)  $P' = 0 \rightarrow AOQ = \dots$  And  $P' = 1 \rightarrow AOQ = \dots$   
(A) 0, 1                                    (B) 0, 0  
(C) 1, 0                                    (D) 1, 1

- (15) \_\_\_\_\_ plan is very easy to understand.
- (A) Double Sampling      (B) Single sampling  
 (C) Multiple sampling      (D) None of the above
- (16) Which distribution theory follows variable charts works ?
- (A) Normal distribution  
 (B) Binomials distribution  
 (C) Poisson distribution  
 (D) None of the above
- (17) On the basis of which distribution 'C' chart is ?
- (A) Poisson distribution      (B) Normal distribution  
 (C) Binomials distribution      (D) None of the above
- (18) How many type of possible errors in acceptance sampling ?
- (A) Two      (B) Three  
 (C) Four      (D) One
- (19) P-chart is chart for what ?
- (A) Attribute      (B) Variable  
 (C) Both (A) and (B)      (D) None of the above
- (20) Difference between maximum and minimum value of sample is called
- (A) Range      (B) Standard deviation  
 (C) Mean      (D) None of the above

**2 Define chisquare test for goodness of fit. 12**

**OR**

**2 Four coins were tossed 160 times and the following result 12 were obtained.**

No of head (x)	0	1	2	3	4
Observed frequency (F)	17	52	54	31	06

Test the hypothesis that the coin is unbiased.

- 3** For the ANOVA methods information do analysis of variance. **12**

A(12)	C(19)	B(10)	D(8)
C(18)	B(12)	D(6)	A(7)
B(22)	D(10)	A(5)	C(21)
D(12)	A(7)	C(27)	B(17)

**OR**

- 3** Discuss by example for ANOVA method for one way classification. **12**

- 4** Explain responsibility of S.Q.C. unit ? (Statistical Quality Control). **13**

**OR**

- 4** From the following information prepare  $\bar{x}$  and R charts : **13**

Sample no.	1	2	3	4	5	6	7	8	9	10	Total
Range R	6	4	6	8	4	7	7	5	6	5	58
Mean $\bar{x}$	51	46	43	47	45	44	37	49	43	37	442

[For  $n = 4$ ,  $A_2 = 0.729$ ,  $D_3 = 0$ ,  $D_4 = 2.282$ ]

- 5** Write a note Single Sampling Plan (SSP). **13**

**OR**

- 5** Write a note. Double Sampling Plan (DSP). **13**